

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટનને 2021 માટે કેનેડામાં મેકલીનની શ્રેષ્ઠ સમુદાયો માટેની યાદીમાં #13 તરીકે માન્યતા મળી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 9, 2021) – મેકલીન-સ મેગેઝીન દ્વારા સીટી ઓફ બ્રેમ્પટનને **2021 માટે કેનેડાના શ્રેષ્ઠ સમુદાયો** પૈકી એક તરીકે માન્યતા મળી, જે દેશમાં રહેવા લાયક શ્રેષ્ઠ સ્થળો માટે અપાતું એક ક્રમાંકન (રેટિંગ) છે.

ગયા વર્ષે, બ્રેમ્પટનને આ યાદીમાં 199^{મું} સ્થાન મળ્યું હતું. આ વર્ષે, બ્રેમ્પટનને 415 શહેરોમાં 13 મું સ્થાન મળ્યું. આ ક્રમાંકન દરેક સમુદાયની ટોચની લાક્ષણિકતાઓની ઝાંખી દર્શાવે છે, જ્યાં બ્રેમ્પટનની સામુદાયિક સામેલગીરી, સગવડતાઓ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીએ આ શહેરને કેનેડામાં રહેવાના અને દૂરસ્થ રહીને (રિમોટલી) કામ કરવાના ટોચના સ્થળો પૈકી એક તરીકે તારવ્યું.

મેકલીનનું દેશમાં રહેવાના શ્રેષ્ઠ સ્થળોનું નવું અજોડ ક્રમાંકન COVID-19 મહામારીને અને ઘણાં લોકો ઘરે રહીને કામ અને અભ્યાસ કરતા હોવાની બાબતને ધ્યાનમાં લે છે. એનવિરોનિક્સ એનાલીટિક્સ અને કેનેડિયન ઇન્ટરનેટ રજીસ્ટ્રેશન ઓથોરિટી (CIRA) દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા, તેમજ વિવિધ સ્ત્રોતોમાંથી ઉપલબ્ધ જાહેર આંકડાઓનો ઉપયોગ કરીને, તેઓ સરેરાશ વ્યક્તિને કેટલી મહત્વની માને છે તેના આધારે તેઓએ શ્રેણીબદ્ધ શ્રેણીઓ પર ભાર મૂક્યો અને દરેક મ્યુનિસિપાલિટીને તદ્દનુસાર ક્રમાંકન આપ્યું.

મેકલીનના ક્રમાંકનમાં પરવડી શકે તેવા આવાસો, વસ્તીમાં વધારો, કરવેરા, ગુનાઓ, આબોલવા, આરોગ્ય સંભાળ, સગવડો સુધી પહોંચ અને સામુદાયિક વચનબદ્ધતાને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. તેમાં CIRA નાં ડેટા આધારિત પ્રોડબેન્ડના પરફોર્મન્સને ક્રમાંકન આપતી નવી શ્રેણી પણ સમાવવામાં આવી હતી.

વધુ માહિતી માટે અને પૂરી યાદી જોવા વેબસાઈટ જુઓ, www.macleans.ca

અવતરણો (ક્વોટ્સ):

“બ્રેમ્પટન એક સુરક્ષિત, ટકાઉ અને સફળ શહેર છે અને મેકલીન-સ દ્વારા કેનેડાના શ્રેષ્ઠ સમુદાયો પૈકી એક તરીકે તેમજ એક જ વર્ષમાં #199 પરથી #13 માં સ્થાને પહોંચવાની માન્યતા મળવા બદલ હું અતિશય ગૌરવ અનુભવું છું. અમે અમારા રહેવાસીઓ માટે એક એવા સમૂદાય શહેરનું નિર્માણ કરવાનું ચાલુ રાખ્યું છે જે જોડાયેલું, ટકાઉ, સર્વગ્રાહી અને ભાવિ આર્થિક વિકાસ અને રોજગાર સર્જન માટે સારી સ્થિતિમાં હોય.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“મેકલીન-સ દ્વારા કેનેડાના શ્રેષ્ઠ સમુદાયો પૈકી એક તરીકે માન્યતા મળવી એ આપણું રહેવાસીઓ માટે અર્થસરભર પરિણામો પૂરા પાડવા અમારી ટીમ દ્વારા કરાતા કાર્યને પ્રતિબિંબિત કરે છે. અમે અમારા સમુદાય માટે પરિણામો વિતરિત કરવા, અને કાઉન્સિલની અગ્રતાઓની પરિભાષાને આગળ ધપાવવા કટિબદ્ધ છીએ, અમે બ્રેમ્પટનને રહેવા, કામ કરવા અને રમવા લાયક પસંદગીનું સ્થળ બનાવવાનું ચાલુ રાખીશું.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूहात्मक संवाद

सीटी ओफ् ब्राम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca